

સમગ્ર શહેરમાં યોજનારા વૃક્ષારોપણ કાર્યક્રમોમાં સહભાગી થઈને બ્રેમ્પટનને હરિયાળુ બનાવો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 11, 2019) – એપ્રિલ 22 નાં રોજ અર્થે 2019 ની ઉજવણીમાં, સીટી ઓફ બ્રેમ્પટન આગામી અઠવાડિયાઓમાં ચાર સામુદાયિક વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.

નીચેના આયોજનો થવાના છે.

શનિવાર, એપ્રિલ 27 | સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી

- નોર્ટન પ્લેસ પાર્ક, 170 ક્લાર્ક બુલેવર્ડ
વૃક્ષારોપણ અને મફતમાં બારબેક્યુ.
- ટેરામોટો પાર્ક, 9020 ષિંગકુસી રોડ
ક્રેડિટ વેલી કન્ઝર્વેશન સાથેની ભાગીદારીમાં મફત વૃક્ષારોપણ.
- ક્લેઈરવિલે કન્ઝર્વેશન એરિયા, 8998 ક્લેઈરવિલે કન્ઝર્વેશન રોડ
ટોરોન્ટો એન્ડ રીજીયન કન્ઝર્વેશન ઓથોરિટી સાથેની ભાગીદારીમાં મફત વૃક્ષારોપણ.

શનિવાર, મે 4 | સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી

- વેલીબ્રૂક પાર્ક, 244 પ્રેસ બ્રિક ડ્રાઈવ
ટોરોન્ટો એન્ડ રીજીયન કન્ઝર્વેશન ઓથોરિટી સાથેની ભાગીદારીમાં વાર્ષિક સ્કાઉટ કમ્યુનિટી વૃક્ષારોપણ અને મફતમાં બારબેક્યુ.

વૃક્ષારોપણ કાર્યક્રમો પૈકી એકમાં નોંધણી કરાવવા, વેબસાઈટ www.brampton.ca/parks જુઓ. નોંધણી કરાવવાની છેલ્લી તારીખ એપ્રિલ 25 છે. સહભાગીઓએ હવામાનને અનુરૂપ પોશાક પહેરવો જોઈએ અને અંગૂઠો ઢંકાય તેવા શૂઝ પહેરવા જોઈએ. પાવડો અને હાથમોજા પૂરા પાડવામાં આવશે, પરંતુ તે સીમિત હોય છે. સહભાગીઓને તે પોતે લાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જો શક્ય હોય. આયોજનો ચોકકસ યોજાશે પછી ભલે વરસાદ થાય કે તડકો પડે.

અર્થ ડે (પૃથ્વી દિવસ) વિશે

અર્થ ડે નેટવર્ક અર્થ ડે 2020 સુધીમાં 7.8 બિલિયન વૃક્ષોનું રોપણ કરવાનો હેતુ ધરાવે છે - આ ગ્રહ (પૃથ્વી) પર દરેક વ્યક્તિ માટે એક વૃક્ષ. સંસ્થાના કહેવા પ્રમાણે, 192 દેશોમાં એક બિલિયન (અબજ) ઉપરાંત લોકો અર્થ ડે પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, જે તેને દુનિયામાં સૌથી મોટા પાયે થનારી એક શહેરી પ્રવૃત્તિ બનાવશે.

અવતરણ (ક્વૉટ):

“આ કાઉન્સિલની અગ્રતાઓ પૈકી એક અગ્રતા બ્રેમ્પટનને હરિયાળુ શહેર બનાવવાની છે, અને આપણાં સમુદાય સાથે પ્રવૃત્તમય રહેવા અને પર્યાવરણલક્ષી સંરક્ષણ વિશે જાગૃકતા ફેલાવવા અર્થ ડે એક ચડિયાતી તક છે. હું દરેક વ્યક્તિને, ખાસ કરીને આપણાં જુવાનોને, વધારે સારું ભવિષ્ય બનાવવામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું. પર્યાવરણલક્ષી પહેલો, જેમ કે વૃક્ષારોપણ, સંરક્ષક અને સંરક્ષણ પ્રત્યે જવાબદારી અને કટિબદ્ધતાની સમજને પાળવી-પોષવી.”

- મેયર પેટ્રિક બ્રાઉન (*Patrick Brown*)

-30-

सीटी ओफ़ ब्राम्पटन विशे विषे वधु माडिती माटे अडीं मुलाकात वो www.brampton.ca अमने झूवो करे [Twitter](https://twitter.com) पर, [Facebook](https://facebook.com) पर, अने [Instagram](https://instagram.com) पर.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

क्रोओडिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ़ ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca